



# ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુર

ICAR-Central Institute for Cotton Research, Nagpur

An ISO 9001:2015 Certified Organization



## જી ૧૩ નવેમ્બર ૨૦૨૭ દરમાન કપાસની ખેતી પદ્ધતિ માટે રૂપ મી અઠવાડિક સલાહ

ગુજરાત	છેલ્લા અઠવાડિયામાં પડેલ ખરેખર વરસાદ (મીભી)					આગામી અઠવાડિયા માટે સુચિત / પુર્વાનુમાન વરસાદ (મીભી)				
	નવેમ્બર					નવેમ્બર				
	૩	૪	૫	૬	૭	૮	૯૦	૯૧	૯૨	૯૩
	અમરેલી	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	ભાવનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જામનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	રાજકોટ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જુનાગઢ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	સાબરકાંઠા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	સુરેન્દ્રનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	અમદાવાદ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	વડોદરા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	પાટણ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	મહેસૂસાથા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
કુલ પડેલ વરસાદ અને પ્રમાણિત રંગ	૦.૧ થી ૨.૪ મીભી	૨.૫ થી ૧૫.૫ મીભી	૧૫.૬ થી ૬૪.૪ મીભી	૬૪.૫ થી ૧૧૫.૫ ૧૧૫.૫	૬૪.૫ થી ૧૧૫.૫ ૧૧૫.૫	૧૧૫ થી ૨૦૪.૪ મીભી				
પડેલ વરસાદનું વર્ગીકરણ	ખૂબ જ ઓછો વરસાદ	ઓછો વરસાદ	મધ્યમ વરસાદ	ભારે વરસાદ	અતિ ભારે વરસાદ					

### પાક પરિસ્થિતિ :

સુરત ખાતે વાવણી કરેલ પાક ૧૩૭ થી ૧૩૮ દિવસનો જીડવા વિકાસ થી પરિપક્વ અવસ્થાએ છે. કેટલાંક ખેતરોમાં લીલાં તડતડીયા, મોલોમશી અને ગુલાબી ઈયળની વસ્તુઓ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવેલ છે. કોરીનોસ્પોરા ખૂણિયાં ટપકાંનો રોગ અને લાલ પાન થવાનો રોગ ઓછા પ્રમાણમાં અને પાનના ખૂણિયાં ટપકાંનો રોગ વધુ પ્રમાણમાં નોંધાયેલ છે.

જુનાગઢ ખાતે વાવણી કરેલ પાક ૧૩૭ દિવસનો કુલ, જીડવા વિકાસની અને જીડવા ખૂલવાની અવસ્થાએ છે. પિયત આપવાની અને દવા છાંટવાની કામગીરી થયેલ છે. કેટલાંક સ્થળોએ લીલાં તડતડીયાનો ઉપદ્રવ આર્થિક ક્ષમ્ય માત્રાથી વધુ નોંધાયેલ છે. ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળનાં કુંદા આર્થિક ક્ષમ્ય માત્રાથી વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. મોટા ભાગના ખેતરોમાં આંતરીક જીડવાનો કોહવારો અથવા સડો નોંધવામાં આવેલ છે.

### સલાહ :

સુરત ખાતે ખેડૂતોને, જો ચુસીયાં પ્રકારની જીવાતો તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુજી @ ૪ ગ્રામ અથવા ડાયનોટેક્સ્યુરાન ૨૦ એસજી @ ૩ ગ્રામ અથવા ૬૮મીડાક્લોપીડ ૧૭.૮ એસએલ @ ૩ મીલી અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી @ ૨૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. ગુલાબી ઈયળની મોજણી માટે ફેરોમોન ટ્રેપ (૫ પ્રતિ હેક્ટર) લગાડવા. ગુલાબી ઈયળ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે (૧૦% ફ્લાઉ ભાગોમાં નુકશાન અથવા સતત ૩ દિવસ સુધી ૮ કુંદાં પ્રતિ ટ્રેપ પ્રતિ રાત્રિ) ત્યાં સાયપરમેશ્વરીન ૧૦% ઈસી @ ૧૦-૧૫ મીલી અથવા સાયપરમેશ્વરીન ૨૫% ઈસી @ ૪-૬ મીલી અથવા લેમ્ડા સાયએલોશ્ની ૫% ઈસી @ ૧૦ મીલી અથવા ડેલ્ટામેશ્વરીન ૨.૮ ઈસી @ ૧૦ મીલી અથવા ફેનોપ્રોપાશ્નીન ૧૦% ઈસી @ ૧૫-૨૦ મીલી અથવા ફેનવેલેરેટ ૨૦ ઈસી @ ૧૦ મીલી અથવા આલ્ફાસાયપરમેશ્વરીન ૧૦% ઈસી @ ૬ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. ઉગેલ પાકમાં હલ્કી જીમિનમાં જીકની ઉણપને ઓછી કરવા યુરીયા @ ૨% અને જીક સલ્ફેટ ૨૦% @ ૦.૫% પ્રમાણે અને મેનેશેલીયમની ઉણપને ઓછી કરવા મેનેશેલીયપ સલ્ફેટ @ ૧ કિલો/ ૧૦૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવું. જીડવાનું બેસાણ સુધારવા અને ફુલોનું ખરડા અટકાવવા પોટેશિયમ નાઈટ્રેટ (૧૩:૦:૪૫) @ ૨% એટલે કે ૨ કિલો પોટેશિયમ નાઈટ્રેટ ૧૦૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો અથવા નેથેલીક એસેટીક એસીડ ૪.૫ એસએલ @ ૪.૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટવું. બીટી કપાસમાં લાલ પાન થવાની સમસ્યાનાં નિયંત્રણ માટે સંપૂર્ણ ખેતરમાં ફુલોનું બેસાણ વધુ હોય ત્યારે અને જીડવા વિકાસની અવસ્થાએ એમ બે વખત ૧૫ દિવસનાં આંતરે મેનેશેલીયમ સલ્ફેટ @ ૧% + યુરીયા ૧% આપવું. જીડવાનો સડો અને ખૂણિયાં ટપકાંનો રોગ આવતો અટકાવવા માટે કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ ડબલ્યુપી/ ડબલ્યુજી @ ૨૫-૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે આપી વ્યવસ્થાપન કરવું. છોડમાં જોવા મળતા કોરીનોસ્પોરા, અલ્ટરનેરીયા કુગથી થતાં ટપકાંઓ તથા મૂળનાં કોહવારા અને અચ્યુત્રાઈ જેવાં રોગોનાં વ્યવસ્થાપન માટે કાર્બન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૬ ઉંસ ડબલ્યુપી @ ૩૦ ગ્રામ અથવા પ્રોફીક્નોનોલોજી ૨૫ એસસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ફલુક્ષાપાયરોક્ષાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાક્લોસ્ટોભીન ૩૫૩ ગ્રામ/ લી. એસસી @ ૬ મીલી અથવા

એજોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા કેસોક્ષીમ-મીથાઈલ ૪૪.૩% એસસી @ ૧૦ મીલી અથવા મેટીરામ ૫૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાની સલાહ આપવમાં આવે છે.

જુનાગઢ ખાતે ખેડુતોનેપાકમાં ગુલાબી ઈયળનાં કુદાની મોજણી કરવા માટે એકર ટિઠ ૨ ફેરોમોન ટ્રેપ લગાડવા અને પાકમાં કુદાની વસ્તીની નોંધણી કરવાની સલાહ આપવામાં આવે છે. ગુલાબી ઈયળ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે (૧૦% ફળાઉ ભાગોમાં નુકશાન અથવા સતત ઉદ્ઘાસ સુધી ૮ કુદાની પ્રતિ ટ્રેપ પ્રતિ રાત્રિ) ત્યાં સાયપરમેશ્વીન ૧૦% ઈસી @ ૧૦-૧૫ મીલી અથવા સાયપરમેશ્વીન ૨૫% ઈસી @ ૪-૬ મીલી અથવા લેમ્ડા સાયહેલોથીન ૫% ઈસી @ ૧૦ મીલી અથવા ડેલ્ટામેથીન ૨.૮ ઈસી @ ૧૦ મીલી અથવા ફેનોપ્રોપાથીન ૧૦% ઈસી @ ૧૫-૨૦ મીલી અથવા ફેનવેલેરેટ ૨૦ ઈસી @ ૧૦ મીલી અથવા આલ્ફાસાયપરમેશ્વીન ૧૦% ઈસી @ ૬ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. જીડવાનો સર્ડો અને ખૂણિયાં ટપકાનો રોગ આવતો અટકાવવા માટે કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ડબલ્યુપી/ ડબલ્યુજી @ ૨૫-૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે આપી વ્યવસ્થાપન કરવું. છોડમાં જોવા મળતા કોરીનેસ્પોરા અને કુગથી થતાં ટપકાંઓ જેવાં રોગોનાં વ્યવસ્થાપન માટે કાર્બન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૬૫% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાજોલ ૨૫ ઈસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ફલુક્ષાપાયરોક્ષાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્ટ્રોબીન ઉત્તર ગ્રામ/ લી. એસસી @ ૬ મીલી અથવા એજોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા મેટીરામ ૫૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાની સલાહ આપવમાં આવે છે. ગે મીલડયુને નિયંત્રિત કરવા એજોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા કેસોક્ષીમ મીથાઈલ ૪૪.૩% એસસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૬૫% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટવાની ભલામણ છે. ખેતરમાંથી સંક્રમિત જીડવાઓ અને પાકનાં અવશેષો ભેગા કરીને નાશ કરવો.

કપાસ ઉત્પાદનની તાંત્રિકતા આધારિત વિસ્તૃત માહિતી દા.ત. જમીનની પસંદગી, જાતો/ સંકરો, ખાતર આપવાની પદ્ધતિ, વાવણીની રીત, પિયત પદ્ધતિઓ, નિંદામણ, કિટકો અને રોગોનું વ્યવસ્થાપન વિગેરેની માહિતી એન્ટ્રોઇડ આધારીત CICR Cotton App. કે જે ICAR-CICR, નાગપુર દ્વારા તૈયાર કરેલ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં, પાક વૃદ્ધિ અવસ્થા અને હવામાન આધારિત અઠવાડિક સલાહ ICAR-CICR, નાગપુરની વેબસાઈટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે જેનો લાભ ખેડુતો લઈ શકે છે.